

ઈ-મેઇલ આઇડી

કેવાયસી

પાસપોર્ટ

વિગ્રહ

(પ્રથમ અરજદાર)

પાસપોર્ટ નં.

ઇશ્યુ કર્યાનું સ્થળ

સમયમર્યાદા સમાપ્ત થવાની તારીખ

વિગ્રહ નં.

વિગ્રહનો પ્રકાર સ્ટુડન્ટ વિગ્રહ નિવાસની મંજૂરી (રેસિડેન્સ પરમિટ) સીડીસી વર્ક વિગ્રહ

સમયમર્યાદા સમાપ્ત થવાની તારીખ

સરનામાનો પુરાવો
(સંદર્ભાવ્યવહાર માટે પસંદ કરવામાં આવેલા સરનામા માટે)

આધાર નં.

પાન નં. ☐ ફોર્મ 60 ☐ ફોર્મ 49A

સીકેવાયસી આઇડી

☐ આવકવેરા અધિનિયમની કલમ 206ABની જોગવાઈઓ મુજબ, હું જાહેર કરું છું કે, હું ભારતમાં મારું કોઈ કાયમી પ્રતિષ્ઠાન (વ્યવસાયનું સ્થળ) ધરાવતો/ધરાવતી નથી. હું બાંધપરો આપું છું કે, તેમાં કોઇપણ ફેરફાર થાય કે તરત જ બેંકને તેની જાણ કરીશ.

કૃપા કરીને પ્રથમ અરજદારનો ફોટો ચોટાડો

સ્થળ:

તારીખ:

પ્રથમ અરજદારની સહી

(બીજા અરજદાર)

સ્ટુડન્ટ વિગ્રહ નિવાસની મંજૂરી (રેસિડેન્સ પરમિટ) સીડીસી વર્ક વિગ્રહ

☐ આવકવેરા અધિનિયમની કલમ 206ABની જોગવાઈઓ મુજબ, હું જાહેર કરું છું કે, હું ભારતમાં મારું કોઈ કાયમી પ્રતિષ્ઠાન (વ્યવસાયનું સ્થળ) ધરાવતો/ધરાવતી નથી. હું બાંધપરો આપું છું કે, તેમાં કોઇપણ ફેરફાર થાય કે તરત જ બેંકને તેની જાણ કરીશ.

કૃપા કરીને બીજા અરજદારનો ફોટો ચોટાડો

સ્થળ:

તારીખ:

બીજા અરજદારની સહી

પૂરી પાડવામાં આવતી સેવાઓ

☐ જો બયત ખાતા માટે એસએમએસ એવર્ટ જોઇતા હોય તો કૃપા કરીને ટીક કરો કિટનો પ્રકાર ☐ ઇન્સ્ટા-કિટ ☐ પર્સનલાઇઝ્ડ કિટ (જો પસંદ કરવામાં આવે તો કૃપા કરીને નીચેની વિગતો ભરો)

ચેકબુક ☐ હા ☐ ના શું તમે પોલિટિકલ એક્સપોઝ્ડ પર્સન (પીઇપી) છો કે તેમની સાથે સંકળાયેલા છો? ☐ હા ☐ ના

ડેબિટ કાર્ડ	એનઆરઈ બયત	એનઆરઓ બયત	ડેબિટ કાર્ડ પર નામ
પ્રથમ અરજદાર	☐	☐	
બીજા અરજદાર	☐	☐	

ઘોષણાઓ

સગીર ખાતા માટેની ઘોષણા (જો લાગુ થતું હોય તો)

વાલીનો પ્રકાર: ☐ પિતા ☐ માતા ☐ કોર્ટ દ્વારા નિમવામાં આવેલ

હું આથી જાહેર કરું છું કે, સગીર કે જે મારા છે, તેમની જન્મ તારીખ છે અને હું તેમના કુદરતી અથવા કાયદેસરના વાલી/કોર્ટના આદેશથી તારીખે નિમવામાં આવેલા વાલી છું (નકલ બીડવામાં આવી છે). જ્યાં સુધી સગીર પુખ્ત વયના ના થાય ત્યાં સુધી હું ઉપરોક્ત ખાતામાં ભવિષ્યમાં થનારી કોઈ પણ પ્રકારની તમામ લેવડદેવડોમાં સગીરનું પ્રતિનિધિત્વ કરીશ. હું જાહેર કરું છું કે, આ ખાતામાંથી મારા દ્વારા ઉપાડવામાં આવેલી રકમનો ઉપયોગ સગીરના લાભ માટે કરવામાં આવશે. હું ઉપરોક્ત સગીરના કોઇપણ ઉપાડ/લેવડદેવડના દાવાની સામે બેંકના નુકસાનની ભરપાઈ કરીશ અને નુકસાનની ભરપાઈ કરતો રહીશ.

પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) માટેની ઘોષણા (જો લાગુ પડતું હોય તો)

આથી હું અહીં જાહેર કરું છું કે, હું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છું. હું નીચેની શરતોમાંથી કોઈ એકને પૂરી કરું છું અને તેની સાથે અહીં નીચે આપેલી ઘોષણાના સમર્થનમાં કેટલાક સહાયક દસ્તાવેજો બિડી રહ્યો છું/રહી છે. (કૃપા કરીને નીચે આપેલા વિકલ્પોમાંથી તમને લાગુ પડતો વિકલ્પ પસંદ કરો)

- ☐ હું ભારતીય પાસપોર્ટ ધરાવતો/ધરાવતી હતો/હતી મારા પિતા/માતા/દાદા/દાદી ભારતના નાગરિક છે/હતી
- ☐ હું ભારતીય નાગરિકનો/ની જીવનસાથી છું
- ☐ હું પીઆઇઓ/ઓસીઆઇઓ/ની જીવનસાથી છું
- ☐ હું પીઆઇઓ/ઓસીઆઇ કાર્ડધારક છું. હું એવા પ્રદેશનો/ની હતો/હતી, જે 15મી ઓગસ્ટ, 1947 પછી ભારતનો ભાગ બન્યો હતો.

મરિનર ખાતાની ઘોષણા (જો લાગુ પડતું હોય તો)

હું આથી જાહેર કરું છું અને પુષ્ટિ કરું છું કે, હું એક બિન-નિવાસી ભારતીય છું અને હાલમાં હું કંપની સાથે કરારબદ્ધ છું, જે (મુખ્ય કંપનીનું સરનામું)માં નોંધાયેલી છે. હું વિનંતી કરું છું કે, મારા નામે એનઆરઈ/એનઆરઓ બયત ખાતું રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે ખોલવામાં આવે. હું એ વાતની પણ પુષ્ટિ કરું છું કે, જો હું મારા કરારને રીન્યૂ ના કરું અથવા નવો કરાર કરું અથવા નવો કરાર ના કરી શકું કે કોઇપણ સંજોગોમાં મારી બિન-નિવાસી ભારતીયની સ્થિતિમાં ફેરફાર થાય, તો આ અંગે હું બેંકને જાણ કરીશ. તદ્દનુસાર, હું મારા નામે ખોલવામાં આવેલા બિન-નિવાસી ખાતાઓને નિવાસી ખાતાઓમાં પરિવર્તિત કરાવીશ.

બિન-નિવાસી ભારતીય માટેની ઘોષણા

હું/અમે આથી અહીં જાહેર કરું છું/કરીએ છીએ કે, હું/અમે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (એફએમએ 1999)ની કલમ 2(w)માં સમયાંતરે કરવામાં આવેલા સુધારા મુજબ, વ્યાખ્યાયિત કરવામાં આવેલા બિન-નિવાસી ભારતીય(ઓ) ('એનઆરઆઈ')/પર્સન(ન્સ) ઓફ ઇન્ડિયન ઓરિજિન ('પીઆઇઓ') છું/છીએ. હું/અમે સમજીએ છીએ કે ઉપરોક્ત ખાતું મારા/અમારા દ્વારા આપવામાં આવેલા નિવેદનો/ઘોષણાઓના આધારે ખોલવામાં આવશે, અને હું/અમે એ બાબતે પણ સંમત થઈએ છીએ કે, જો અહીં આપવામાં આવેલા કોઇપણ નિવેદનો/ઘોષણાઓ ભૌતિક વિગતોમાં ખોટા/ગેરમાર્ગે દોરનારા જણાશે તો, બેંક મારા/અમારા કોઇપણ ખાતા ખોલવાની અરજીને સ્વીકારવા અને/અથવા તેની પર પ્રક્રિયા હાથ ધરવા માટે બંધાયેલી રહેશે નહીં. હું એ પણ સમજું છું કે, બેંક પોતાની સંપૂર્ણ મુનસફી મુજબ, મને કોઇપણ સૂચના આપ્યાં વગર કોઇપણ સેવાઓને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બંધ કરી શકે છે. હું રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ('આરબીઆઈ'), કોમન રીપોર્ટિંગ સ્ટાન્ડર્ડ ('સીઆરએસ') અને સમયાંતરે અમલમાં હોય તેવી અન્ય કોઇપણ સરકારી અથવા નિયામકીય સત્તા દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા તમામ લાગુ પડતા નિયમો, વિનિયમો, સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરીશ અને તેનું પાલન કરવા માટે બાધ્ય રહીશ.

સ્થળ:

તારીખ

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

પ્રથમ અરજદારની સહી

બીજા અરજદારની સહી (જો લાગુ પડતું હોય તો)

પ્રારંભિક ચૂકવણી અને સંચાલનના મોડની વિગતો

એનઆરઆઈ બચત ખાતું	એનઆરઓ બચત ખાતું																																																																																																																																																																				
સંચાલનની સૂચના: અન્ય (ફૂપા કરીને સ્પષ્ટ કરો) <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>સિંગલ</td> <td>જોઇન્ટલી</td> <td>આઇધર ઓર સર્વાઇવર</td> <td>ફોર્મર ઓર સર્વાઇવર</td> </tr> </table>	સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર	ફોર્મર ઓર સર્વાઇવર	સંચાલનની સૂચના: અન્ય (ફૂપા કરીને સ્પષ્ટ કરો) <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>સિંગલ</td> <td>જોઇન્ટલી</td> <td>આઇધર ઓર સર્વાઇવર</td> <td></td> </tr> </table>	સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર																																																																																																																																																													
સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર	ફોર્મર ઓર સર્વાઇવર																																																																																																																																																																		
સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર																																																																																																																																																																			
ચૂકવણીનો મોડ: ☐ ચેક ☐ ડીડી ☐ એનઇએફટી/આરટીજીએસ ☐ નિલ આઇપી ચેક/ડીડી નં.:, જેને શાખાના નામે લખવામાં આવ્યો આઇપીની રકમ: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> શબ્દોમાં											ચૂકવણીનો મોડ: ☐ ચેક ☐ ડીડી ☐ એનઇએફટી/આરટીજીએસ ☐ નિલ આઇપી ચેક/ડીડી નં.:, જેને શાખાના નામે લખવામાં આવ્યો આઇપીની રકમ: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> શબ્દોમાં																																																																																																																																																										
એનઆરઆઈ બાંધી મુદતની થાપણ સંચાલનની સૂચના: અન્ય (ફૂપા કરીને સ્પષ્ટ કરો) <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>સિંગલ</td> <td>જોઇન્ટલી</td> <td>આઇધર ઓર સર્વાઇવર</td> <td>ફોર્મર ઓર સર્વાઇવર</td> </tr> </table>	સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર	ફોર્મર ઓર સર્વાઇવર	એનઆરઓ બાંધી મુદતની થાપણ સંચાલનની સૂચના: અન્ય (ફૂપા કરીને સ્પષ્ટ કરો) <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>સિંગલ</td> <td>જોઇન્ટલી</td> <td>આઇધર ઓર સર્વાઇવર</td> <td></td> </tr> </table>	સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર																																																																																																																																																													
સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર	ફોર્મર ઓર સર્વાઇવર																																																																																																																																																																		
સિંગલ	જોઇન્ટલી	આઇધર ઓર સર્વાઇવર																																																																																																																																																																			
ચૂકવણીનો મોડ: ☐ ચેક ☐ ડીડી ☐ એનઇએફટી/આરટીજીએસ ☐ નિલ આઇપી જના બેંક ખાતા નં.: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> ચેક/ડીડી નં.:, જેને શાખાના નામે લખવામાં આવ્યો આઇપીની રકમ: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> શબ્દોમાં મુદત: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td></tr></table> દિવસો ચૂકવવાપાત્ર વ્યાજ: <table border="1" style="display: inline-table;"><tr><td>માસિક</td><td>ત્રિમાસિક</td><td>અર્ધ વાર્ષિક</td><td>વાર્ષિક</td><td>સંચિત</td></tr></table> પાકતી મુદતના સૂચન <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો</td> <td>ફક્ત મુદ્દલને રીન્યૂ કરો</td> <td>રીન્યૂ કરશો નહીં</td> </tr> </table> વ્યાજ/પાકતી મુદતની રકમ આમાં જમા કરવામાં આવશે: ☐ જના બેંકનું ખાતું ☐ અન્ય બેંકનું ખાતું (ફૂપા કરીને અહીં નીચે સ્પષ્ટ કરો) ખાતા નં.: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> આઇએફએસસી <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> બેંક: શાખા:																																			માસિક	ત્રિમાસિક	અર્ધ વાર્ષિક	વાર્ષિક	સંચિત	મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો	ફક્ત મુદ્દલને રીન્યૂ કરો	રીન્યૂ કરશો નહીં																																									ચૂકવણીનો મોડ: ☐ ચેક ☐ ડીડી ☐ એનઇએફટી/આરટીજીએસ ☐ નિલ આઇપી જના બેંક ખાતા નં.: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> ચેક/ડીડી નં.:, જેને શાખાના નામે લખવામાં આવ્યો આઇપીની રકમ: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> શબ્દોમાં મુદત: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td></tr></table> દિવસો ચૂકવવાપાત્ર વ્યાજ: <table border="1" style="display: inline-table;"><tr><td>માસિક</td><td>ત્રિમાસિક</td><td>અર્ધ વાર્ષિક</td><td>વાર્ષિક</td><td>સંચિત</td></tr></table> પાકતી મુદતના સૂચન <table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <tr> <td>મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો</td> <td>ફક્ત મુદ્દલને રીન્યૂ કરો</td> <td>રીન્યૂ કરશો નહીં</td> </tr> </table> વ્યાજ/પાકતી મુદતની રકમ આમાં જમા કરવામાં આવશે: ☐ જના બેંકનું ખાતું ☐ અન્ય બેંકનું ખાતું (ફૂપા કરીને અહીં નીચે સ્પષ્ટ કરો) ખાતા નં.: <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> આઇએફએસસી <table border="1" style="display: inline-table;"><tr><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td><td></td></tr></table> બેંક: શાખા:																																			માસિક	ત્રિમાસિક	અર્ધ વાર્ષિક	વાર્ષિક	સંચિત	મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો	ફક્ત મુદ્દલને રીન્યૂ કરો	રીન્યૂ કરશો નહીં																																								
માસિક	ત્રિમાસિક	અર્ધ વાર્ષિક	વાર્ષિક	સંચિત																																																																																																																																																																	
મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો	ફક્ત મુદ્દલને રીન્યૂ કરો	રીન્યૂ કરશો નહીં																																																																																																																																																																			
માસિક	ત્રિમાસિક	અર્ધ વાર્ષિક	વાર્ષિક	સંચિત																																																																																																																																																																	
મુદ્દલને વ્યાજ સાથે રીન્યૂ કરો	ફક્ત મુદ્દલને રીન્યૂ કરો	રીન્યૂ કરશો નહીં																																																																																																																																																																			

શું તમે ખાતા માટે નોમીની પસંદ કરવા માગો છો?

☐ હા, હું નોમિનેટ કરવા માગું છું ☐ ના, હું નોમિનેટ કરવા માગતો/માગતી નથી

બેંક ડિપોઝિટના સંબંધમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 45ઝેડ એ અને બેંકિંગ કંપનીઝ (નોમિનેશન) રુલ્સ, 1985ના નિયમ 2(1) હેઠળ નોમિનેશન.

હું/અમે નીચેની વ્યક્તિને નોમિનેટ કરીએ છીએ, જેથી કરીને મારા/અમારા/સગીરના મૃત્યુના કિસ્સામાં, ઉપરોક્ત ખાતામાં જમા થયેલી રકમ જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ દ્વારા તેમને પરત કરી શકાય.

નોમીનીનું નામ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

પિતા-પતિનું નામ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

અટક

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

નોમીનીનું સરનામું ☐ પ્રાથમિક ખાતાધારકના સંદેશાવ્યવહારના સરનામાને સમાન ☐ અપડેટ થયેલું સરનામું અહીં નીચે મુજબ છે

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

થાપણદાર સાથેનો સંબંધ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

નોમીનીની જન્મતારીખ

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

જો નોમીની સગીર** હોય તો, ફૂપા કરીને આ વિભાગને પૂરેપૂરો ભરો. આ તારીખના રોજ નોમીની સગીર હોવાથી, હું/અમે નિમણૂક કરું છું/કરીએ છીએ:

વાલીનું નામ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

પિતા-પતિનું નામ

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

અટક

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

વાલીનું સરનામું

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

જના સ્મોલ ફાઇનાન્સ બેંક
(એક શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેંક)

[illegible]

હું/અમે અહીં જાના સ્મોલ ફાઇનાન્સ બેંકને મારા/અમારા આધાર/કેવાયસી અથવા અન્ય કોઇપણ વિગતોને સ્ટેન્ડલ કેવાયસી રજિસ્ટ્રી/ક્રેડિટ બ્યુરો/કોઇપણ એજન્સીઓ સાથે કાયદાની આવશ્યકતા મુજબ શેર કરવા અને આ એજન્સીઓ પાસેથી માહિતી મેળવવા માટે મારી/અમારી સ્પષ્ટ સંમતિ આપીએ છીએ. આ રીતે અધિકૃત કોઇપણ એજન્સીઓ, નિયામકો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યાં મુજબ, પ્રોસેસ કરેલી માહિતી અને ડેટા અથવા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોને બેંકો/નાણાકીય સંસ્થાઓ અને અન્ય વિરાણ આપનારાઓ અથવા નોંધાયેલા યુઝર્સને વિચારણા માટે આપી શકે છે.

હું/અમે આથી બેંકને મારા/અમારા કેવાયસીના વ્યક્તિગત દસ્તાવેજોને જે વિદેશી ભાષામાં છે તેમના થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર સાથે શેર કરવા માટે અધિકૃત કરીએ છીએ, જેઓ તેને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાના હેતુથી તેમના પેટા-કોન્ટ્રાક્ટરોને આગળ મોકલશે. હું/અમે સમજીએ છીએ અને સંમત છીએ કે ખાતા ખોલવા/ફરીથી કેવાયસી અપડેટ કરવા/અથવા કોઇપણ સેવા વિનંતીની પ્રોસેસિંગના હેતુ માટે કેવાયસી અપડેટનો એક હિસ્સો હોય તેવા મારા/અમારા કેવાયસીના વ્યક્તિગત દસ્તાવેજોમાં વિદેશી ભાષામાં દર્શાવેલી વિગતો અને માન્યતાની ખાતરી કરવા માટે બેંક દ્વારા અનુવાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

ઇન્ટરનેટ બેંકિંગ:

જના એસએફબીએ એનઆરઈ/એનઆરઓ ખાતાઓ પર ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ ઇશ્યુ કરવા/ચાલુ કરવા માટે અધિકૃત કરવામાં આવેલી છે. જાના સ્મોલ ફાઇનાન્સ બેંકની ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરવા પર ખાતાધારક www.janabank.com વેબસાઇટ પર જણાવ્યાં મુજબ સમયાંતરે અમલમાં આવતાં નિયમો અને શરતોનું પાલન કરવા માટે બાધ્ય રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડને સુરક્ષિત, સલામત અને સંરક્ષિત રાખવાની જવાબદારી ખાતાધારકની છે. જાના સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. ઇન્ટરનેટ બેંકિંગના યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા આપેલી સૂચનાઓના આધારે કોઇપણ લિફ્ટ કરાવેલા ખાતાઓમાંથી ડેબિટ થતી રકમ માટે ખાતાધારક પોતે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ માટે બેંકને જવાબદારી ઠેરવી શકાશે નહીં. આ સેવાઓ સાથે સંકળાયેલી ફી, ડ્યુટી કે અન્ય ચાર્જિસ લાગુ થશે. લિફ્ટ કરવામાં આવેલા તમામ ખાતાઓ (જેમાં ખોલવામાં આવનાર કોઇપણ નવું ખાતું પણ સામેલ છે)ને સમયાંતરે અમલમાં આવતાં નિયમો મુજબ ઇંડ ટ્રાન્ઝેક્શન સુધિ હેઠળ આવતી લેવામાં આવશે. સંયુક્તપણે સંચાલિત થતાં ખાતાઓ સિવાય તમામ વ્યક્તિગત ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા આપી શકાય છે. હાલમાં ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા કોઇને પણ ઉપલબ્ધ નથી.

મોબાઇલ બેંકિંગ:

નોંધણી માટે ફોર્મમાં પૂરો પાડવામાં આવેલો મોબાઇલ નંબર સાચો હોય તેની ખાતરી કરવાની જવાબદારી ખાતાધારકની છે. લેવડદેવડ સંબંધિત એવર્ન અને વન-ટાઇમ પાસવર્ડ આ નોંધાયેલા મોબાઇલ નંબર પર જ મોકલવામાં આવશે. નોંધાયેલા મોબાઇલ નંબર(રો) દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપવામાં આવેલી સૂચનાઓ પર ખાતામાંથી ડેબિટ થતી રકમ માટે ખાતાધારક પોતે સંપૂર્ણપણે જવાબદાર ગણાશે. આ સેવાઓ સાથે સંકળાયેલી ફી, ડ્યુટી કે અન્ય ચાર્જિસ લાગુ થશે. ખાતાધારક કે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તરફથી આ સેવાઓ સંબંધિત ભૂલના કિસ્સામાં, બેંક જવાબદાર ગણાશે નહીં અને ખાતાધારક સંમત થાય છે કે, બેંક સામે આ સંબંધે કોઈ દાવો કરવામાં આવશે નહીં. બેંક તેની સંપૂર્ણ મુનસફી મુજબ, કોઇપણ સમયે આ સુવિધા અને અહીં નિર્દિષ્ટ નિયમો અને શરતોને બંધ કરી શકે છે/બદલી શકે છે/સુધારી શકે છે અને આ અંગે સમયાંતરે www.janabank.com પર અપડેટ કરવામાં આવશે. મોબાઇલ બેંકિંગની સુવિધા સંયુક્તપણે સંચાલિત થતાં ખાતાઓ સિવાય તમામ વ્યક્તિગત ગ્રાહકોને આપી શકાય છે.

એફએટીસીએ-સીઆરએસ ધોષણા - કૃપા કરીને લાગુ પડતી ટેક્સ રેસિડેન્ટ ધોષણા (કોઇપણ એક) પર ટિક કરો (ફરજિયાત)

☐ હું ભારતનો ટેક્સ રેસિડેન્ટ છું અને અન્ય કોઈ દેશનો રેસિડેન્ટ નથી અથવા ☐ હું નીચેના કોષ્ટકમાં ઉલ્લેખિત દેશ(દેશો)નો ટેક્સ રેસિડેન્ટ છું:
કૃપા કરીને અહીં નીચે એ દેશ(દેશો)નો ઉલ્લેખ કરો કે જેમાં એન્ટી ટેક્સ હેતુઓ માટે રેસિડેન્ટ છે અને તેની સાથે સંકળાયેલ ટેક્સ આઇડી નંબરો પણ આપો:

*જન્મનું શહેર..... *જન્મનો દેશ.....

કરવેરાના હેતુ માટે સરનામાનો પ્રકાર ☐ રહેણાંક ☐ વ્યવસાય ☐ નોંધાયેલી ઓફિસ

[illegible]

જો તમારી પાસે ટેક્સ પેયર આઇડેન્ટિફિકેશન નંબર/ફંક્શનલ ઇક્વિવેલન્ટ નથી, તો કૃપા કરીને નીચે આપેલા કારણોમાંથી લાગુ પડતા કારણ પર ટિક કરો:

☐ હું ભારતની બહાર રહેતો વ્યક્તિ છું (જો વાગ્યું પડતું હોય તો જ પસંદ કરો):

ટીઆઇએન/ફક્શનલ ઇક્વિવેલન્ટ ઇશ્યૂ નહીં કરી રહેલા દેશો: (ઉલ્લેખ કરો: ☐ વિઝા ☐ રેસિડેન્સ ☐ વર્ક પર્મિટ નંબર)	નાવિક: (સીડીસી4/વિઝા નંબરનો ઉલ્લેખ કરો)
ડીપેન્ડેન્ટ વિઝા નંબર:	સ્ટુડેન્ટ વિઝા નંબર:
નિવાસના દેશમાં પહેલીવાર જઈ રહ્યો/રહી છું (વિઝા નંબરનો ઉલ્લેખ કરો):	

(ટીઆઇએન/ફંક્શનલ ઇક્વિલેન્ટને 90 દિવસની અંદર બેંકને જણાવવાના રહેશે, અન્યથા ખાતું બંધ થઈ જશે).
અથવા

હું ભારતનો નિવાસી છું તેમજ કરવેરાના હેતુઓ માટે પણ ભારતનો નિવાસી છું (ફૂપા કરીને સ્વ-પ્રમાણપત્ર પણ ભરો).

D. જો તમે યુએસની વ્યક્તિ તરીકે 'ના' જાહેર કરી રહ્યાં છો, પરંતુ તમારો જન્મનો દેશ યુએસ છે, તો કૃપા કરીને નાગરિકતા છોડ્યાંનો પુરાવો આપતો દસ્તાવેજ પૂરો પાડો. "જો તે ઉપલબ્ધ ના હોય, તો નાગરિકતા છોડ્યાનું પ્રમાણપત્ર ના હોવાના કારણ(ણો) જણાવો: _____
કૃપા કરીને સ્વ-પ્રમાણપત્ર પણ ભરો."

ગ્રાહકની ધોષણા (તમામ ગ્રાહકોને લાગુ)

- ખોટી જુબાની આપવાના દંડ હેઠળ, હું પ્રમાણિત કરું છું કે:
 - અરજદાર (i) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (‘યુ.એસ.’)ના અથવા તેના કોઇપણ રાજ્ય કે રાજકીય પેટા-વિભાગ (જેમાં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અથવા યુ.એસ.ના અન્ય કોઇપણ રાજ્યોનો સમાવેશ થાય છે)ના (ii) જેની આવક (પછી ભલે તેનો સ્ત્રોત કોઇપણ હોય) યુ.એસ.ના સંઘીય આવકવેરાને આધીન હોય તેવી એસ્ટેટના કાયદા હેઠળ યુએસની વ્યક્તિ તરીકે કરપાત્ર અરજદાર છે. (આ કલમ ફક્ત ત્યારે જ લાગુ પડશે જો ખાતાધારકને યુએસની વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યાં હોય) અથવા
 - અરજદાર ભારતની બહારના દેશના કાયદા હેઠળ ટેક્સ રેસિડેન્ટ તરીકે કરપાત્ર છે. (આ કલમ ફક્ત ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખાતાધારક ભારતની બહારના ટેક્સ રેસિડેન્ટ હોય)
- હું સમજું છું કે એફએટીસીએ/સીઆરએસના પાલનમાં મારું સ્ટેટસ નક્કી કરવાના હેતુસર બેંક આ માહિતી પર આધાર રાખી રહી છે. બેંક એફએટીસીએ/સીઆરએસ અથવા તેની અસર અંગે કોઈ કરવેરા સંબંધિત સલાહ આપી શકશે નહીં. હું કરવેરા સંબંધિત કોઇપણ પ્રશ્નો માટે સલાહકાર પાસેથી સલાહ લઇશ.
- જો આ ફોર્મ પરની કોઇપણ માહિતી કે પ્રમાણપત્ર ખોટું પડે, તો હું 30 દિવસની અંદર નવું ફોર્મ સબમિટ કરવા સંમત થાઉં છું.

- હું સંમત થાઉં છું કે, સ્થાનિક નિયમકો/ટેક્સ સત્તાધિશોની જરૂરિયાત મુજબ, બેંક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને જાણ કરી શકાય તેવી વિગતોની પણ જાણ કરવી પડી શકે છે અથવા મારું ખાતું બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું પડી શકે છે.
- મારા દ્વારા ખોટી/અધૂરી માહિતી પૂરી પાડવાને કારણે બેંકને થતાં કોઇપણ નુકસાન માટે હું બેંકને નુકસાનની ભરપાઈ કરી આપીશ.
- હું પ્રમાણિત કરું છું કે, આ ફોર્મમાં મેં/અમે માહિતી પૂરી પાડી છે અને મારી/અમારી જાણકારી અને માન્યતા મુજબ અરજદારના ટેક્સ પેયર આઇડેન્ટિફિકેશન નંબર/ફંક્શનલ ઇક્વિવેલન્ટ નંબર સહિતનું પ્રમાણીકરણ સાચું, સચોટ અને સંપૂર્ણ છે તથા મેં ફોર્મની માહિતીની જરૂરિયાતો સમજી લીધી છે (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા તારીખ 7 ઓગસ્ટ, 2015ના રોજ નોટિફિકેશન નંબર એસ.ઓ.2155(ઇ) દ્વારા જાહેર કરવામાં આવેલા એફએટીસીએ-સીઆરએસના નિયમો અને શરતો સાથે વાંચો).

પ્રાથમિક અરજદારની સહી: _____ તારીખ: _____ સ્થળ: _____

સ્વ-પ્રમાણીકરણ: (નીચે આપેલા પોઇન્ટ (b) સિવાય એનઆરઆઇ ગ્રાહકોને લાગુ નથી)

ફક્ત તો જ ભરવું જો-

- (a) કોઇપણ સૂચક માપદંડો ભારતની બહારના હોય અને કરવેરાના હેતુઓ માટે ભારતની બહારના નિવાસી ન હોવાથી ટીઆઇએન કે ફંક્શનલ ઇક્વિવેલન્ટ ઉપલબ્ધ ન હોય, અથવા
(b) જન્મનો દેશ યુએસ છે અને યુએસની વ્યક્તિ તરીકે 'ના'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હું પુષ્ટિ કરું છું કે, હું યુએસની વ્યક્તિ નથી કે ભારત સિવાયના અન્ય કોઈ દેશમાં કરવેરાના હેતુસર નિવાસી નથી, ભલે એક કે તેનાથી વધુ માપદંડો ભારતની બહારના દેશ સાથે મારો સંબંધ સૂચવી રહ્યાં હોય. તેથી, હું મારી નાગરિકતા અને/અથવા નિવાસના પુરાવા રૂપે નીચેનો દસ્તાવેજ પૂરો પાડું છું.	પ્રાથમિક અરજદારની સહી:
સોંપવામાં આવેલી દસ્તાવેજી પુરાવો (ફૂપા કરીને સોંપવામાં આવેલા દસ્તાવેજ પર ટિક કરો અને દસ્તાવેજના નંબરનો ઉલ્લેખ કરો): _____	
☐ પાસપોર્ટ ☐ ચૂંટણી ઓળખપત્ર ☐ પાન કાર્ડ ☐ ડ્રાઇવિંગ લાઇસન્સ ☐ યુઆઇડીએઆઇ પત્ર ☐ નરેગા જોબ કાર્ડ ☐ સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું આઇડી કાર્ડ	

નોંધ:

યુનાઇટેડ સ્ટેટ્સ પર્સન શબ્દનો અર્થ થાય છે:

- યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક અથવા નિવાસી હોય તેવી વ્યક્તિ;
- યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કે તેના કોઈ રાજ્યના કાયદા હેઠળ સંસ્થાપિત થયેલી ભાગીદારી અથવા કોર્પોરેશન;
- એક ટ્રસ્ટ જો:
 - (i). યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદરની કોઈ કોર્ટેને લાગુ કાયદા હેઠળ ટ્રસ્ટના સંચાલન સંબંધિત લગભગ તમામ મુદ્દાઓ અંગે આ દેશો આદેશો અથવા ચુકાદાઓ આપવાનો અધિકાર હોય; અને
 - (ii). યુ.એસ.ની એક કે તેનાથી વધુ વ્યક્તિઓને ટ્રસ્ટના તમામ મહત્વપૂર્ણ નિર્ણયોને નિયંત્રિત કરવાનો અધિકાર હોય;
- યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક અથવા નિવાસી હોય તેવા મૃતકની એસ્ટેટ.

ટીઆઇએનના ફંક્શનલ ઇક્વિવેલન્ટમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સામાજિક સુરક્ષા/વીમા નંબર, નાગરિક/વ્યક્તિગત ઓળખ/સેવા કોડ/રાષ્ટ્રીય ઓળખ નંબર, નિવાસી/વસ્તી નોંધણી નંબર, એલિયન કાર્ડ નંબર, વગેરે.

ઘોષણા: આઈ-યૂઝ માય એકાઉન્ટ

હું/અમે _____, આથી ઘોષણા કરું છું/કરીએ છીએ કે મેં/અમે જાના સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. ('બેંક') દ્વારા પૂરાં પાડવામાં આવેલા આઈ-યૂઝ માય એકાઉન્ટ ('આઇસીએમએ') પ્રપોઝિશનને પસંદ કર્યું છે અને એકાઉન્ટ નંબર _____ લેવા માંગું છું. હું/અમે સમજીએ છીએ કે બેંકને આ ખાતા નંબર ઉપલબ્ધતાને આધિન અને ખાતું ખોલવા માટે બેંક દ્વારા પૂરાં પાડવામાં આવેલા તમામ જરૂરી માપદંડો પૂરાં થવાને આધિન મને આ ખાતા નંબર પૂરો પાડવાનો અધિકાર છે.

હું/અમે એ પણ સ્વીકારીએ છીએ કે સોર્સિંગ ઓફિસરે મને/અમને આઇસીએમએ સાથે સંકળાયેલા તમામ લાભ, ઉત્પાદનના પાત્ર વેરિઅન્ટ્સ અને અન્ય વિગતો સમજાવી છે. હું/અમે જાહેર કરું છું કે હું/અમે આ સુવિધા માટે બેંક દ્વારા નિર્ધારિત જરૂરી એક્ઝ્યુબી/એએમબી જાળવી રાખીશું.

હું/અમે વધુમાં સ્વીકારીએ છીએ કે જો બેંકની વેબસાઇટ પર પૂરી પાડવામાં આવેલી પ્રોડક્ટ-વિશેષ જરૂરિયાત પૂરી ન થાય તો બેંકને ખાતાને ડાઉનગ્રેડ કરવાનો અથવા બંધ કરવાનો અધિકાર છે.

તારીખ: _____ સ્થળ: _____

પ્રાથમિક અરજદારની સહી

ગૌણ અરજદારની સહી

ફક્ત ઓફિસના ઉપયોગ માટે

શાખાના અધિકારી દ્વારા પ્રમાણીકરણ

હું પ્રમાણિત કરું છું કે, ખાતું ખોલવાનું ફોર્મ તમામ બાબતોમાં સંપૂર્ણ છે અને સંબંધિત દસ્તાવેજો મેળવી લેવામાં આવ્યાં છે તથા તેને ચકાસી લેવામાં આવ્યાં છે. જો રૂબરૂ ખાતું ખોલવામાં આવે, તો હું પ્રમાણિત કરું છું કે ગ્રાહકે મારી હાજરીમાં સહી કરી છે.

ઇએમપી.કોડ:

ઇએમપી. નામ:

તારીખ:

સહી:

મેન્ડેટનો પત્ર

મેન્ડેટધારકનું નામ

વર્તમાન ગ્રાહક, જો 'હા' હોય તો કૃપા કરીને સીઆરએનનો ઉલ્લેખ કરો

નવા ગ્રાહક, જો 'હા' હોય તો કૃપા કરીને મેન્ડેટધારકના ફોર્મને અવગથી ભરો

એનઆરઈ એસએ ☐ એનઆરઓ એસએનું ☐ સંચાલન કરવા માટેનું મેન્ડેટ

જો વાગુ થતું હોય તો કૃપા કરીને ટિક કરો

☐ એનઆરઈ એસએ

જો વાગુ થતું હોય તો કૃપા કરીને ટિક કરો

☐ એનઆરઓ એસએ

આ સેવાઓની જરૂર છે ☐ ડેબિટ કાર્ડ ☐ મેન્ડેટ ચેકબુક

મેન્ડેટધારકનો મોબાઇલ નંબર

નિયમો અને શરતો

- હું આથી મેન્ડેટધારકને (a) ખાતામાંથી માત્ર સ્થાનિક ચૂકવણીઓ માટે જ ચેક ડ્રો કરવા અધિકૃત કરું છું. (b) મારા વતી, આરબીઆઈ/એફઇએમએ નિયમો દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ એનઆરઈ/એનઆરઓ ખાતામાં જમા કરાવવા માટે પાત્ર ચેક જમા કરવા. (c) જો હું ભારતમાં રોકાણ કરવા માટે પાત્ર હોઉં તો જ, ભારતમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડવા માટે ખાતાનું સંચાલન કરવું. (d) ખાતાના સંબંધમાં બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા બેલેન્સ કન્ફર્મેશન સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ્સને પ્રમાણિત કરવા. (e) ખાતામાં ડેબિટનો સમાવેશ કરતી લેખિત સૂચનાઓ આપવા. (f) મારા નામ પર ખાતામાં ઉપલબ્ધ બેલેન્સમાંથી થાપણો મૂકવા અને ઉપર જણાવેલ મેન્ડેટધારક દ્વારા લેખિતમાં જણાવવામાં આવે એટલા સમયગાળા માટે આવી થાપણોને રીન્યૂ કરવા.
- ઉપરોક્ત મેન્ડેટધારક રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ('આરબીઆઈ') અને એફઇએમએ હેઠળ ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકામાં મંજૂર કરવામાં આવેલી મર્યાદા સુધી જ તેમની સત્તાનો ઉપયોગ કરશે. જ્યાં પણ આરબીઆઈ પાસેથી ચોક્કસ મંજૂરીઓ મેળવવાની જરૂર હોય, ત્યાં આવા વ્યવહારોને બેંક દ્વારા મને આરબીઆઈ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી આવશ્યક મંજૂરીઓને બેંકને સોંપ્યાં પછી જ મંજૂરી આપવી જોઈએ. હું આથી અહીં બાંધકારી આપું છું કે, હું અને મારા મેન્ડેટધારક આરબીઆઈ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999ની જોગવાઈઓ તથા તેના હેઠળ ઘડવામાં આવેલા તમામ વિનિયમો/નિયમોનું પાલન કરીશું, જેમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ડીપોઝિટ) રેગ્યુલેશન્સ, 2000, ફોરેન મેનેજમેન્ટ (ડીપોઝિટ) રેગ્યુલેશન્સ, 2016 અને તેમાં કરવામાં આવેલા તમામ સુધારાઓનો સમાવેશ થાય છે.

3) મારા દ્વારા ખાતાનું સંચાલન કરવા માટે અધિકૃત કરવામાં આવેલા મેન્ડેટધારકની નમૂનાની સહી અહીં નીચે આપેલી છે. સહી મારા દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરવામાં આવી છે અને ચકાસવામાં આવી છે.

- આ અધિકાર અને મેન્ડેટ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી હું બેંકને લેખિતમાં નોટિસ આપીને તેને સ્પષ્ટપણે રદ ન કરું.
- હું જાણું છું કે મેન્ડેટધારકને વિનંતી કરવાથી માત્ર ડોમેસ્ટિક ડેબિટ કાર્ડ જ ઇશ્યૂ કરવામાં આવશે અને તેના ચાર્જિસને એ ખાતામાંથી ડેબિટ કરવામાં આવશે જેના માટે મેન્ડેટધારકની નિમણૂક કરવામાં આવી છે.
- ઉપરોક્ત મેન્ડેટધારક દ્વારા આ મેન્ડેટના આધારે કરવામાં આવેલા તમામ કાર્યો અને કામગીરીઓ મારા પર એટલા જ અસરકારક અને બંધનકર્તા રહેશે જાણે કે આવા કાર્યો અને કામગીરીઓ મેં પોતે કર્યા હોય અને હું કોઇપણ સમયે આવા કોઈ પણ મામલે વિવાદ કરીશ નહીં કે વિવાદ થવા દઇશ નહીં.

મેન્ડેટધારકની સહી

નામ

પ્રથમ અરજદારની સહી

નામ

બીજા અરજદારની સહી

નામ

પ્રારંભિક ચૂકવણી અને નોમિનેશનની સ્વીકૃતિ

☐ હું/અમે તમારા દ્વારા અહીં નીચે જણાવેલી વ્યક્તિના પક્ષમાં કરવામાં આવેલી નોમિનેશન પ્રાપ્ત થયાનું સ્વીકારીએ છીએ:

તમારા અરજી નંબરના સંદર્ભમાં નોમિનીનું નામ.....ઉંમર.....વર્ષ

☐ ખાતાધારક દ્વારા નોમિનેશન સુવિધાનો લાભ લેવામાં આવ્યો ન હોવાથી ખાતા માટે કોઈ નોમિની નથી.

આરબીઆઈની નોમિનેશન માર્ગદર્શિકા અનુસાર, એક જ નામ હેઠળ ખોલવામાં આવેલા ખાતા માટે નોમિનીની નોંધણી કરવી જરૂરી છે. નોમિનીની નિમણૂક કરવી એ અહીં નીચે જણાવેલા કારણોસર ફાયદાકારક છે:

- જો ખાતાધારકનું અવસાન થાય, તો બેંક ખાતામાં રહેલું ભંડોળ નોમિનીને સરળતાથી આપી દેશે.
- લાભનો દાવો કરતી વખતે નોમિનીને ઔપચારિકતાઓ પૂરી કરવામાં કોઈ હેરાનગતિ થતી નથી

ફોર્મ 60

પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર ન ધરાવતા અને જેઓ નિયમ 114Bમાં નિર્દિષ્ટ કરવામાં આવેલા કોઇપણ વ્યવહાર કરનારા ઇન્ડિવિડ્યુઅલ અથવા વ્યક્તિ (કંપની કે ફર્મ ન હોય તેવી) દ્વારા ભરવા માટેનું ઘોષણાપત્ર.

જો પાન માટે અરજી કરી હોય અને તે હજુ સુધી જનરેટ ના થયો હોય, તો અરજી કર્યાની તારીખ ____/____/____ (તાતા/મમ/વવવવ) તથા સ્વીકૃતિ નંબર _____ દાખલ કરો. જો પાન માટે અરજી ના કરી હોય, તો જે નાણાકીય વર્ષમાં ઉપરોક્ત વ્યવહાર થયો હોય તે નાણાકીય વર્ષ માટે અંદાજિત કુલ આવક (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 64 મુજબ જીવનસાથી, સર્ગીર બાળક વગેરેની આવક સહિત) ભરો.

a. કૃષિ સંબંધિત આવક (રૂ.) _____

b. કૃષિ સિવાયની અન્ય આવક (રૂ.) _____

ખરાઈ

હું, _____ આથી અહીં જાહેર કરું છું કે, ઉપર જણાવેલ માહિતી મારી જાણકારી અને માન્યતા અનુસાર સાચી છે. હું વધુમાં એમ પણ જાહેર કરું છું કે, મારી પાસે પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર નથી અને ઉપરોક્ત વ્યવહાર જે નાણાકીય વર્ષમાં થયો છે, તે નાણાકીય વર્ષ માટે મારી/અમારી અંદાજિત કુલ આવક (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 64 મુજબ જીવનસાથી, સર્ગીર બાળક વગેરેની આવક સહિત) આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર ગણવામાં આવે તો, કરપાત્ર ન હોય તેવી મહત્તમ રકમ કરતાં ઓછી હશે.

આજ રોજ ખરાઈ કરવામાં આવી, _____ 20__ નો _____ દિવસ.

અરજદારની સહી: _____

તારીખ: _____ સ્થળ: _____

નોંધ: 1. આ ઘોષણાપત્ર પર સહી કરતા પહેલાં, ઘોષણા કરનારી વ્યક્તિએ એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે આ ફોર્મમાં આપેલી માહિતી તમામ પાસાઓમાં સાચી, સુધારેલી અને સંપૂર્ણ છે. ઘોષણાપત્રમાં ખોટું નિવેદન આપનારી કોઇપણ વ્યક્તિ પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 277 હેઠળ કાર્યવાહી થશે અને દોષિત ઠરવા પર સજાને પાત્ર ગણાશે. (i) એવા કિસ્સામાં જેમાં કર્યોરી પચીસ લાખ રૂપિયાથી વધુ હોય, તેમાં સખત કેદની સજા થશે, જે છ મહિનાથી ઓછી નહીં હોય પરંતુ સાત વર્ષ સુધી લંબાઈ શકે છે અને દંડ પણ થશે; (ii) અન્ય કોઇપણ કિસ્સામાં, સખત કેદની સજા થશે, જે ત્રણ મહિનાથી ઓછી નહીં હોય પરંતુ બે વર્ષ સુધી લંબાઈ શકે છે અને દંડ પણ થશે. 2. ઘોષણાપત્ર સ્વીકારનારી વ્યક્તિ એવા કિસ્સામાં ઘોષણાપત્રને સ્વીકારશે નહીં, જેમાં આઇટમ 22bમાં દર્શાવેલા પ્રકારની આવકની રકમ કરપાત્ર ન હોય તેવી મહત્તમ રકમ કરતાં વધી જાય, સિવાય કે પાન માટે અરજી કરવામાં આવી હોય અને કોલમ 21 યોગ્ય રીતે ભરવામાં આવી હોય.